

M.Com Semester - 3 (CBCS) Examination
DEC/JAN. - 2020 - [NEW COURSE]
Advanced Cost Accounting(Elective (New))

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન.૧ રમેશ લિમિટેડની ઉત્પાદન વિભાગની માહિતી નીચે મુજબ છે. (૧૪)

વિગત	અંદાજપત્રીય	ખરેખર
ઉત્પાદન (એકમો)	10,000	9,500
સ્થિર પરોક્ષ ખર્ચ (₹)	1,00,000	97,500
ચલિત પરોક્ષ ખર્ચ (₹)	30,000	30,000

ઉપરની માહિતી પરથી શોધો.

- (૧) ચલિત પરોક્ષ ખર્ચ વિચલન
- (૨) સ્થિર પરોક્ષ ખર્ચ વિચલન
- (૩) બજેટ વિચલન
- (૪) જથ્થા વિચલન

પ્રશ્ન.૨ વિકાસ લિમિટેડની નીચેની માહિતી પ્રાપ્ય છે. (૧૪)

વસ્તુ	અંદાજીત વેચાણ			ખરેખર વેચાણ		
	એકમો	એકમદીઠ વે.કિં (₹)	કુલ રકમ (₹)	એકમો	એકમદીઠ વે.કિં (₹)	કુલ રકમ (₹)
A	6000	3=50	21000	8000	4=00	32000
B	8000	3=00	24000	10000	2=50	25000
C	10000	2=50	25000	12000	3=00	36000
	24000		70000	30000		93000

નીચેના વિચલનોની ગણતરી કરો.

- (૧) વેચાણ કિંમત વિચલન
- (૨) વેચાણ જથ્થા વિચલન
- (૩) વેચાણ મિશ્રણ વિચલન
- (૪) વેચાણ પેટા જથ્થા વિચલન

પ્રશ્ન.૩ રાજકોટ લિમિટેડ એક વી.સી.ડી. બનાવે છે. તેનું પ્રથમ એકમ બનાવતાં માલસામાન ખર્ચ ₹ 1500 અને (૧૪)

મજૂર કલાકો 330 થાય છે. કલાકદીઠ ₹ 4 મજૂરી પડતર છે. ચલિત પડતર કલાક દીઠ ₹ 3 છે. જો

ઉત્પાદન અંગે 90% અધ્યયન વક્રની અસર હોય તો પ્રથમ 1 એકમ અને 8 એકમોનું ઉત્પાદન કરવાની કુલ પડતર શોધો. અને એકમદીઠ સરેરાશ પડતર શોધો.

પ્રશ્ન.૪ ટુંકનોંધ લખો. (૧૪)

1. પડતર ધટાડાનું મહત્વ.
2. પડતર અંકુશનાં લક્ષણો.

1. કાર્યક્ષમતા વિચલન અને કેલેન્ડર વિચલન
2. વેચાણગાણા મિશ્રણ વિચલન અને વેચાણગાણા પેટા જથ્થા વિચલન
3. પ્રવૃત્તિ આધારિત પડતર નિર્ધારણનાં તબક્કાઓ.
4. પડતર ઓડિટનાં ફાયદાઓ.

ENGLISH VERSION

Q.1 Information of Production department of Ramesh Limited is as follows.

(14)

Particular	Budgeted	Actual
Production (Units)	10,000	9,500
Fixed Overhead Cost (₹)	1,00,000	97,500
Variable Overhead Cost (₹)	30,000	30,000

Find out from above details.

- (1) Variable Overhead Cost Variance
- (2) Fixed Overhead Cost Variance
- (3) Budget Variance
- (4) Volume Variance

Q.2 Following details are available of Vikash Limited.

(14)

Product	Budgeted Sales			Actual Sales		
	Units	Per Unit Selling Price (₹)	Total (₹)	Units	Per Unit Selling Price (₹)	Total (₹)
A	6000	3=50	21000	8000	4=00	32000
B	8000	3=00	24000	10000	2=50	25000
C	10000	2=50	25000	12000	3=00	36000
	24000		70000	30000		93000

Calculate the following variance.

- (1) Sales Price Variance
- (2) Sales Volumes Variance
- (3) Sales Mix Variance
- (4) Sales Sub-Volume Variance

Q.3 Rajkot Limited is manufacturing V.C.D. product to prepare. The First unit material cost Rs 1500 and Labor hours are 330. Labor cost is Rs.4 per hour. Variable cost is Rs.3 per hour. If learning curve effect is 90% on production.

(14)

Then find out cost of First 1 unit and 8 units produce, total cost and find out per unit Average cost.

Q.4 Write short note.

(14)

1. The Importance of Cost Reduction.
2. The characteristics of Cost control.

Q.5 Write note. (any two)

(14)

1. Efficiency variance and calendar variance.
2. Sales margin mix variance and Sales margin sub volume variance.
3. The Stages of Activity based costing.
4. The advantages of cost Audit.
